

# ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ, અમદાવાદ

## નિગમની ૨૦૧૦-૧૧ ની સિધ્ધીઓ

નિગમના ૧૮ જેટલા જિલ્લા / તાલુકા કક્ષાએ પોતાના ખેત સેવા કેન્દ્રો અને નિગમ દ્વારા પ્રમાણિત કરેલ ૧૩૦૦ જેટલા ખાનગી સાહસિકોના છુટક વેચાણ કેન્દ્રો સમગ્ર રાજ્યમાં ધરાવે છે. નિગમ ગુજરાતના ખેડૂતોને સદર કેન્દ્રો મારફત કૃષિલક્ષી સેવાઓ અને રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, ટ્રેક્ટર અને ખેતીને લગતાં ઓજારોનું વેચાણ કરે છે.

નિગમ ભારતના માન. વડાપ્રધાનના ૨૦ મુદ્દાના કાર્યક્રમ હેઠળ બાયોગેસની સ્થાપનાના અમલીકરણ માટે નોડલ એજન્સીની ભૂમિકા ભજવે છે. આ સ્કીમ ૧૯૮૧ ના વર્ષથી અમલમાં છે અને દર વર્ષે ભારત સરકાર દ્વારા સુચિત લક્ષ્યાંક મુજબ સિધ્ધકરવામાં આવે છે.

વિશ્વ વ્યાપી ઉદારીકરણને અનુલક્ષીને રાજ્યમાં ખાનગી ક્ષેત્રમાં કૃષિ ઉદ્યોગના ઝડપી વિકાસ માટે નિગમ દેશ વિદેશના આ ક્ષેત્રની આગળ પડતી કંપનીઓ, ઉદ્યોગ સાહસિકો અને તજજ્ઞો સાથે સતત પરામર્શમાં રહે છે.

રાજ્યમાં કૃષિ પેદાશો પર આધારિત ઉદ્યોગોની સ્થાપનાને રાજ્ય સરકારે નવી કૃષિ ઉદ્યોગ નીતિ જાહેર કરેલ છે. કૃષિ ક્ષેત્રના ઉદ્યોગોનો રાજ્યમાં સર્વાંગી વિકાસ થાય તે હેતુથી નિગમ દ્વારા નોડલ એજન્સી તરીકે કૃષિ ઉદ્યોગ નીતિનું અમલીકરણ કરવામાં આવે છે. કૃષિ પેદાશ પર આધારિત ઉદ્યોગોમાં દેશ અને વિદેશના રોકાણકારોને અનુકુળ વાતાવરણ ઉભું કરવા માટે જરૂરી સમગ્ર પાસાંઓને આવરી લેતી એગ્રો ઈન્ડસ્ટ્રીયલ પોલીસીમાં આંતરમાળખાકીય સુવિધાઓ, ખેત ઉદ્યોગ એકમો દ્વારા મુલ્યવૃદ્ધિ, માર્કેટીંગ / નિકાસ, એગ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એગ્રી વેસ્ટ, ગુણવત્તા સુધારણા કાર્યક્રમ વગેરે વિવિધ પાસાંઓને આવરી લેવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારની મીનીસ્ટ્રી ઓફ ફુડ ઈન્ડસ્ટ્રીઝ (MFPI) તેમજ એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફુડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરીટી (APEEDA) ની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ લાભો ગુજરાતના ઉદ્યોગ સાહસિકો મેળવે અને કાર્યમાં સરળતા રહે તે માટે નિગમ નોડલ એજન્સી તરીકે તેની ભૂમિકા નિભાવી રહ્યું છે.

### **ડુંગળીની નિકાસ માટેની કેનેલાઈઝીંગ એજન્સી તરીકેની કામગીરી :-**

વર્ષ ૨૦૦૯-૧૦ દરમિયાન ડુંગળીની નિકાસ માટેના ૩૧૯૭૩૭.૪૭૮ મે.ટન ડુંગળીની નિકાસ માટેના "ના વાંધા પ્રમાણપત્ર" ઈસ્યુ કરવામાં આવેલ છે. અત્યાર સુધી માં એટલે કે તા. ૩૧-૧૨-૨૦૧૦ સુધીમાં ૧,૪૯,૭૩૩.૯૧૪ મે.ટન મે.ટન ડુંગળીની નિકાસ માટેના "ના વાંધા પ્રમાણપત્ર" ઈસ્યુ કરવામાં આવેલ છે.

રાજ્ય સરકારના કૃષિ અને સહકાર વિભાગના વિવિધ સ્તરોના પ્રદર્શનો, મેળાવડાઓ યોજવા તેમજ કૃષિ ઉદ્યોગ ક્ષેત્રે મૂડીરોકાણ આકર્ષવા માટેના સેમીનારો યોજવા તેને લગતુ સાહિત્ય બહાર પાડવું વગેરે કામગીરી પણ નિગમ બજાવે છે. કૃષિ મહોત્સવ દરમ્યાન કિસાન રથ / કૃષિ પ્રદર્શન તૈયાર કરવાની કામગીરી નિગમ દ્વારા કરવામાં આવે છે.

**એમ.ઓ.યુ. :-**

### **કૃષિ ઉદ્યોગ ક્ષેત્રે મૂડી રોકાણ માટેના એમ.ઓ.યુ.**

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-૫ (૨૦૧૧) દરમ્યાન એગ્રો અને ફુડ પ્રોસેસીંગ ક્ષેત્રે મૂડીરોકાણ માટેના જુદી જુદી પાર્ટીઓ સાથે એમ.ઓ.યુ. કરેલ છે. ૭૧૮ પ્રોજેક્ટોમાં રૂ.૩૮૦૦૦ કરોડ જેટલી રકમનું મૂડીરોકાણ આવવાની સંભાવના છે.

નિગમ દ્વારા રાજ્ય સરકારની નોડલ એજન્સી તરીકે નીચે મુજબની કૃષિ આંતરમાળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટોનું અમલીકરણ પૂર્ણ કરી દીધું છે.

- (૧) ઝઘડીયા ખાતે કેળાનું પેકહાઉસ અને બે કલેક્શન સેન્ટર રૂ. ૬૩૬.૭૨ લાખ
- (૨) બાગાયત પાકો માટે ઈન્ટીગ્રેટેડ પેકહાઉસ નરોડા ખાતે રૂ. ૬૬૭.૭૯ લાખ
- (૩) સરદારવલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાની મથકે સેન્ટર ફોર પેરીશેબલ કાર્ગો રૂ. ૫૦૮.૦૦ લાખ
- (૪) આદીવાસી વિસ્તાર માં ૩ નાના કોલ્ડ સ્ટોરેજ બરથાડ, નાના-પોંઢા, અને ઝઘડીયા ખાતે આદીજાતી વિકાસ વિભાગ વતી અમલીકરણ પૂર્ણ કરેલ છે. પાવી જેતપુર ખાતે આ વર્ષ ના અંત સુધીમાં પૂર્ણ કરવા માં આવશે.

નિગમ દ્વારા કૃષિ આંતરમાળખાકીય સુવિધાઓમાં નીચે જણાવેલ પ્રોજેક્ટો અમલીકરણ હેઠળ છે.

- (૧) બટાકા માટે નેધર લેન્ડની ટેકનોલોજીથી આધુનિક કોલ્ડ સ્ટોરેજ અને પેકહાઉસની ડીસા ખાતે સ્થાપના જે વર્ષ ૨૦૧૧-૧૨ માં પૂર્ણ થશે.
- (૨) ડુંગળી માટે આધુનિક કોલ્ડ સ્ટોરેજ અને પેકહાઉસની મહુવા એ.પી.એમ.સી. ખાતે સ્થાપના વર્ષ ૨૦૧૦-૧૧ માં પૂર્ણ થશે
- (૩) ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર (બી.એ.આર.સી.) ની સહાયથી એગ્રો અને ફૂડ પ્રોડક્ટ માટે રેડિએશન પ્રોસેસીંગ ફેસિલીટીની સ્થાપના જે વર્ષ ૨૦૧૧-૧૨ માં પૂર્ણ થશે
- (૪) નિગમ દ્વારા સૌ પ્રથમ વખત ગત કેરી ની સીઝન દરમ્યાન ગુજરાત ની કેસર કેરી ને દિલ્હી અને અમદાવાદ ખાતે નિગમ દ્વારા સ્થાપવામાઠ આવેલ ઈન્ટીગ્રેટેડ પેકહાઉસમા પ્રોસેસ કરી ગ્રાહકો સુધી પહોંચાડવાની કામગીરી નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડ, ભારત સરકાર

ની સહાય થી કરવામાં આવી હતી. સૌ પ્રથમ વખત કેસર કેરી ના બગીચાઓના માલીકોની મંડળીઓ દ્વારા કાર્બોઈડ ફી કેસર કેરી અમદાવાદ માં ૨૧૬ મે.ટન અને દિલ્હીમાં ૩૪ મે.ટન સીધા ગ્રાહકોને વેચાણ કરવામાં આવી હતી.

## ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ, અમદાવાદ

છેલ્લા ત્રણ વર્ષ ની સિધ્ધીની વિગતો

(૧) નાણાકિય કામગીરી:

નિગમની છેલ્લા ત્રણ વર્ષની કામગીરી નીચે મુજબ છે.

વર્ષ	વેચાણ (રૂ.લાખ માં)	નફો (રૂ.લાખમાં)
૨૦૦૮-૦૯	૨૭૧.૭૦.૧૬	(+) ૨૫૧.૭૫ ઓડીટેડ
૨૦૦૯-૧૦	૨૯૪૬૭.૩૬	(+) ૬૫૯.૬૨ ઓડીટેડ
૨૦૧૦-૧૧	૨૬૯૦૫.૭૨	(+) ૫૮૭.૮૦ અન ઓડીટેડ

(ડીસેમ્બર-૨૦૧૦ સુધી)

(૨) ભૌતિક કામગીરી:

વિગત	૨૦૦૮-૦૯ ઓડીટેડ	૨૦૦૯-૧૦ ઓડીટેડ	૨૦૧૦-૧૧ અન ઓડીટેડ ડીસેમ્બર-૨૦૧૦ સુધી
વેચાણ:			
૧ ટ્રેક્ટર (નંગ માં)	૪	૧	૨
૨ સ્ટોરેજ બિન	૬૯૮૧૪	૮૧૩૮૩	૬૩૮૯૫
૨ ખાતર (ટનમાં)	૩૮૯૨૧૫	૪૧૧૫૩૪	૩૪૮૫૦૭
ઉત્પાદન:			
(૧) જંતુનાશક દવાઓ:			
ક. પાવડર (ટનમાં)	૭૬૮	૮૭૮	૭૯૯
ખ. પ્રવાહી (કિ.લી.માં)	૧૪૮	૨૬૬	૧૭૯
(૨) બાયોગેસ પ્લાન્ટ (નંગ માં)	૫૨૨૨	૯૦૫૦	૧૪૮૨
(૩) ડુંગળી નિકાસ માટે " ના વાંધા પ્રમાણ પત્ર" (મે.ટન)	૨૬૯૬૭૨	૩૧૯૯૨૫	૭૨૦૩૩